

જાન્યુઆરી 19, 2018

ડાઉનટાઉન બ્રામ્પટન રોમાંચક પરિવર્તન હાથ ધરવા આગળ વધી રહ્યું છે સ્ટ્રીટસ્કેપિંગ પ્રોજેક્ટ મંત્રાલય તરફથી આગળ વધવાનો સક્રિય મેળવે છે

બ્રામ્પટન, ઓન્ટેરિયો - વિરાટ કામગીરીઓ હાથ ધરવામાં આવી રહી છે. સીટી ઓફ બ્રામ્પટનને પર્યાવરણ અને હવામાન ફેરફાર મંત્રી તરફથી ડાઉનટાઉન બ્રામ્પટન સ્ટ્રીટસ્કેપિંગ એસેસમેન્ટ પ્રોજેક્ટ માટે મંજૂરી મળી છે, જે ડાઉનટાઉન રિઈમેજીન્ડ તરીકે પણ જાણીતો છે. આ નિર્ણય વડે, શહેર પર્યાવરણ મૂલ્યાંકન પ્રમાણે સ્ટ્રીટસ્કેપિંગ (સ્ટ્રીટનો દેખાવ) અને ક્રોસ-સેક્શનના ચડિયાતી પસંદગીના કામ માટે વિગતવાર ડિઝાઇન તબક્કામાં આગળ વધશે, પણ એ શરત સાથે કે કોઈ બોજમય વિસ્તારોમાં શક્ય હોય ત્યાં સુલભ પાર્કિંગ જગ્યાઓ રાખવાની રહેશે અને તે સાર્થકલ લેનને અવરોધશે નહીં.

આગામી મહિનાઓમાં, વિગતવાર ડિઝાઇન તબક્કો પ્રગતિમય બને એટલે, હિત ધરાવતા ભાગીદારોને ડિઝાઇનના “જુઓ અને અનુભવો” માટેના વિકલ્પો રજૂ કરવામાં આવશે અને તેઓ પાસે પ્રતિભાવ પૂરો પાડવાની તક રહેશે. ડાઉનટાઉન રિઈમેજીન્ડનો હેતુ ડાઉનટાઉનના પુનરોદ્ધાર પ્રયત્નોની છબી અને જાગૃકતા વધારવા સુંદર સૌંદર્યમય વાતાવરણ ઊભું કરવાનો છે. પ્રોજેક્ટના મુખ્ય હેતુઓ છે:

- એવી સ્ટ્રીટ બનાવવી જે ડાઉનટાઉનમાં ચાલવાની શક્યતા અને વટેમાર્ગુઓની ક્ષમતાને પહોંચી વળે
- આ સ્ટ્રીટ્સને સચેતન બનાવવી અને બહુવિધ પાસાઓના અભિગમને આવરી લેતું સ્થળ બનાવવું
- વટેમાર્ગુઓ, સાયકલિસ્ટ્સ અને મોટરિસ્ટ્સને સુરક્ષિત અને સ્થિર રાખીને સાથે લાવવા
- સુવિધાઓ વધારવી અને જાહેર વિસ્તારમાં સુઘડ પરિવર્તન લાવવું

ડાઉનટાઉન રિઈમેજીન્ડ પ્રોજેક્ટને રિજીયન ઓફ પીલના એક બહુવર્ષીય પ્રોજેક્ટ ડાઉનટાઉન બ્રામ્પટન કેપિટલ પ્રોજેક્ટ તબક્કો 1 સાથેના સહયોગમાં હાથ ધરવામાં આવી રહ્યો છે, જે ડાઉનટાઉનના પાયામાં નવી પાણીની લાઈનો અને સેનિટરી ગટરો ફરી નાખીને કે બદલીને જીર્ણ પામી રહેલી માળખાગત સુવિધાઓને બદલી નાખશે. પ્રોજેક્ટનું બાંધકામ 2018 ની પાનખર ઋતુમાં શરૂ થવાની અપેક્ષા રાખવામાં આવે છે.

વિતેલા વર્ષ ઉપરાંતના સમયમાં, આ પ્રોજેક્ટ માટે ઘણી તપાસ કામગીરીઓ કરવામાં આવી છે. આમાં પ્રી-એન્જીનીયરિંગ, વિવિધ યુટિલિટીસ સાથે સહયોગ અને ડાઉનટાઉનના ધંધાઓ માટે એમ્બેસેડર કાર્યક્રમની શરૂઆતનો સમાવેશ થાય છે.

સીટી ઓફ બ્રામ્પટન અને રિજીયન ઓફ પીલ બાંધકામ દરમિયાન વિક્ષેપ ઓછામાં ઓછો કરવા અને ટ્રાફિક અને વટેમાર્ગુઓની અવરજવર સુરક્ષિત કરવાની ખાતરી આપવા તમામ ભાગીદારો સાથે મળીને કામ કરવા કટિબદ્ધ છે. માહિતી મેળવવા વેબસાઈટ્સ જુઓ, www.peelregion.ca/downtownbrampton, www.brampton.ca/downtownstreetscaping અથવા 15 Queen St. W. માં ડાઉનટાઉન રિઈમેજીન્ડ સ્ટોરની મુલાકાત લો.

-30-

બ્રામ્પટનમાં મોટા પાયે ફેરફારો થઈ રહ્યાં છે. આપણે વેધક ધ્યાન કેન્દ્રિત કરતા ભવિષ્ય માટે તૈયાર સંસ્થા છીએ. આપણે આપણાં સમુદાયની વૃદ્ધિ જાણીએ છીએ, જુવાની અને વિવિધતા આપણને અલગ અલગ કરે છે. આપણે કેનેડાના નવીન શોધ કરતા સુપર કોરિડોરના કેન્દ્રમાં સ્થિત, રોકાણ પ્રોત્સાહક અને આપણી વૈશ્વિક સફળતા વિકસાવનાર છીએ. આપણે કંપાયમાન શહેરી કેન્દ્રો વિકસાવીએ છીએ જે તક પ્રજ્વલિત કરે છે અને અહીં રહેતા અને કાર્યરત લોકોમાં ગૌરવ રેડીએ છીએ. આપણે બ્રામ્પટનને આગળ વધારી રહ્યાં છીએ જે તેને નવીનતમ, સર્વગ્રાહી અને જુરસામય શહેર બનાવે. અમને [Twitter](https://twitter.com/brampton) અને [Facebook](https://facebook.com/brampton) પર અનુસરો. www.brampton.ca પર વધુ માહિતી જાણો.

मीडिया संपर्क (MEDIA CONTACT)

नाटाली स्टोगडिल (Natalie Stogdill)

मीडिया कोऑर्डिनेटर (Media Coordinator)

सीटीओ ऑफ ब्राम्पटन (City of Brampton)

905.874.3654 | natalie.stogdill@brampton.ca